



સાક્ષર ભારત



સત્યમેવ જયતે



સાક્ષર ભારત

“જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે; અને તે દૂર કરવી જ જોઈએ.”

– મહાત્મા ગાંધી

સાક્ષરતા અને નિરંતર શિક્ષણ નિયામકની કચેરી

બ્લોક નં. ૧૨, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૦૨૫, ૨૩૨૫૪૦૨૪, ફેક્સ નં. ૨૩૨૫૪૦૨૩

“સાક્ષર ભારત” કાર્યક્રમ

સાક્ષરતા પરીક્ષા આયોજન ૨૦ મી ઓગસ્ટ - ૨૦૧૭

:- નવસાક્ષર મુલ્યાંકન કાર્યક્રમ :-

- રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, રાજ્ય સાક્ષરતા મિશન પ્રાધિકરણ અને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી સંસ્થાન દ્વારા લેવાનાર નવસાક્ષરો માટેની આ AOL પરીક્ષાનું તા. ૨૦/૦૮/૨૦૧૭, રવિવારના રોજ સમગ્ર દિવસ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.
- પરીક્ષામાં બેસવા અગાઉથી ગ્રામ્ય પ્રેરકોને પોતાના નામ નોંધાવી શકાશે. અગાઉ નામ ન નોંધાયેલ હોય તો પણ પરીક્ષાના દિવસે ગામની પ્રાથમિક શાળા ખાતે નામ નોંધાવી આ પરીક્ષામાં બેસી શકાશે.
- આપના ગામમાં જ પ્રાથમિક શાળા/લોક શિક્ષણ કેન્દ્ર ખાતે નવસાક્ષર માટે પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- રાષ્ટ્રીય સાક્ષરતા મિશન અને રાજ્ય સાક્ષરતા મિશન પ્રાધિકરણ તેમજ રાજ્ય સંશોધન કેન્દ્ર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો તમામ નવસાક્ષરોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
- રાષ્ટ્રીય સાક્ષરતા મિશન પ્રાધિકરણ દ્વારા આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ નવસાક્ષરોને તે અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

:- પરીક્ષામાં કોણ બેસી શકે? :-

- પ્રૌઢ શિક્ષણ, અવૈધિક શિક્ષણ કાર્યક્રમમાં લખતાં, વાંચતાં - ગણતાં શીખ્યા હોય તે...
- સાક્ષરતા, નિરંતર શિક્ષણ, “સાક્ષર ભારત” કાર્યક્રમમાં લખતાં, વાંચતાં- ગણતાં શીખ્યા હોય તે...
- પ્રાથમિક શાળાનું શિક્ષણ અથવા વચ્ચે છોડી દીધું હોય, તેમની પાસે પ્રમાણપત્ર ન હોય તે...
- ૧૫ વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ/પુરુષો જેને લખતાં, વાંચતાં - ગણતાં આવડે છે, પરંતુ પ્રમાણપત્ર ધરાવતાં ન હોય તે...

:- મુલ્યાંકનમાં બેસવા :-

- ગ્રામ લોકશિક્ષણ કેન્દ્રનાં પ્રેરક, સરપંચશ્રી, પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકનો સંપર્ક કરી શકશો.

“આંગણે અવસર લાભ ઉઠાવો,

પરીક્ષા આપી સાક્ષર કહેવડાવો”

“ હવે નહી કહેવાઈએ નિરક્ષર,

પરીક્ષા આપી થઈશું સાક્ષર”



સાક્ષર ભારત

જય સાક્ષરતા



સાક્ષર ભારત